

ત્વરિત જાહેરાત માટે

## સીટી ઓફ બ્રમ્પટન ઓક્ટોબરને લઘુ વ્યવસાય માસ તરીકે સ્વીકારે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (01 ઓક્ટોબર 2021) – ઓક્ટોબર લઘુ વ્યવસાય માસ છે અને સીટી ઓફ બ્રમ્પટન સ્થાનિક ઉદ્યોગસાહસિકોને વધારી લે છે જેમના વિચારો, જુસ્સો અને નિશ્ચય શક્તિ સમુદાયને સ્પર્ધાત્મક અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે.

સમસ્ત ઓક્ટોબરમાં ઈકોનોમિક ડેવેલપમેન્ટ ઓફિસનો ભાગ એવું બ્રમ્પટન આંત્રપ્રુન્યોર સેન્ટર (BEC) લઘુ વ્યવસાયોના સમુદાય માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામિંગ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સનો આખો કાર્યક્રમ યોજશે જેમાં માર્કેટિંગ, ડિઝાઇન ટૂલ્સ, બુકકિપિંગ, ઈનકોર્પોરેટિંગ અને બીજા ઘણા વિષયોને આવરી લેવામાં આવશે. વધુ વિગતો અને ઇવેન્ટ રજીસ્ટ્રેશન અહીં કરી શકાશે [www.brampton.ca/BEC](http://www.brampton.ca/BEC).

ઓક્ટોબરમાં અને લઘુ વ્યવસાય માસના માનમાં BEC બિઝનેસ માઈલસ્ટોન પ્રોગ્રામનું લોકાર્પણ પણ કરી રહ્યા છે. એવા લઘુ વ્યવસાયો જેમાં દસ અથવા ઓછા કર્મચારીઓ હોય જેમણે COVID-19 મહામારી દરમિયાન માર્ગદર્શન કર્યું હોય અને સ્થિતિસ્થાપકતા દર્શાવી હોય જેઓ તેની એનિવર્સરી કે માઈલસ્ટોન ઉજવનાર હોય અથવા તો કંઈક ખાસ અથવા અનુપમ કરી રહ્યા હોય તેમને પોતાની વાત BEC સાથે [bec@brampton.ca](mailto:bec@brampton.ca) પર શેર કરવા આમંત્રણ પાઠવીએ છીએ.

વિકાસશીલ શહેર માટે સફળ લઘુ વ્યવસાયો અનિવાર્ય છે, કારણકે તેઓ જ રોજગાર ઊભો કરે છે, અર્થતંત્રને ગતિ આપે છે અને સ્થાનિક પરિસરોને ઉન્નત બનાવે છે. COVID-19 થી મહાનગર બ્રમ્પટનનો સમુદાય અને લઘુ વ્યવસાયો – જે શહેરોની કરોડરજી જાણાય – તે અતિશય પ્રભાવિત થયા છે અને મહામારીમાં તેમને મોટો ફટકો પડ્યો છે.

રહેવાસીઓને શોધ ચલાવવા માટે, પસંદ કરીને સ્થાનિક વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને નીચે આપેલ સૂચનો ધ્યાનમાં રાખવા:

- સ્થાનિક વ્યવસાયોને મદદરૂપ થવા અને સોશયલ મિડિયા પર તમારા ગમતા સ્પોટ્સ પ્રમોટ કરવાનું વિચારો! બ્રમ્પટનના લઘુ વ્યવસાયોની સંપૂર્ણ યાદી માટે અહીં મુલાકાત લો [સપોર્ટ લોકલ બ્રમ્પટન વેબસાઈટ](http://www.brampton.ca/support-local). તેના પર તમારી ઓનલાઈન ટિપ્પણીઓ અન્ય લોકોના લાભાર્થે મુકશો. સોશયલ મિડિયાના એકાઉન્ટ્સ મારફતે સ્થાનિક વ્યવસાયો સાથે પ્રવૃત્ત થશો અને સપોર્ટ લોકલના ચિત્રનો અને હેશટેગ #SupportLocalBrampton નો ઉપયોગ કરીને બ્રમ્પટનના વ્યવસાયોને તમારું સમર્થન દર્શાવશો. સપોર્ટ લોકલ મિડિયા પેક [અહીંથી](http://www.brampton.ca/support-local) ડાઉનલોડ કરી શકાશે.

- બ્રેમ્પટન ફૂડ ગાર્ડમાં બ્રેમ્પટનમાં રહેલા બધી જ અહીં-તો-ખાવું જ-પડશે જેવી જગ્યાઓ શોધો, તમારી કોપિ [અહીંથી](#) ડાઉનલોડ કરો.
- તમારી ગમતી સ્થાનિક દુકાનો ખુલ્લી છે, તમારી રસીની રસીદ બતાવો અને માર્સ્ક પહેરીને સરળતાથી જીમ, હેર સલોન, રેસ્તોરાંમાં અંદર બેસીને જમવા અને બીજું ઘણું બધું કરવા જઈ શકો છો.
- એક બીજાને વાત કરીને મિત્રો અને પરિવારને જણાવો.

સ્થાનિક વસ્તુઓને સપોર્ટ કરવા બાબતની વધુ માહિતી માટે [સપોર્ટ લોકલ બ્રેમ્પટન વેબસાઈટની](#) મુલાકાત લો.

### ઈકોનોમિક રિક્વરી સ્ટ્રેટજી અને સપોર્ટ લોકલ

મહામારી શરૂ થઈ ત્યારથી સિટી તેના લઘુ વ્યવસાયના સમુદાયને મદદરૂપ થવા અને ફરી ઊભા કરવામાં તનતોડ મહેનત કરી રહ્યું છે અને તેને માટે પ્રતિબદ્ધ છે. મે 2020માં બ્રેમ્પટન કાઉન્સિલે [અર્થતંત્રના પુનરુત્થાનની વ્યુહરચના](#) ને સિટી માટેના માળખા તરીકે અનુમોદન આપ્યું જેથી સ્થાનિક અર્થતંત્રને પુનઃ શરૂ કરીને આગળ વધી શકાય. વ્યુહરચનાનો ધ્યેય બ્રેમ્પટનનાં અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મક ફાયદો મેળવી આપવાનો છે જે તેના ચાર કોર્નર સ્ટોન્સની કલ્પના સાથે મેળ ખાતા લાંબા અને ટૂંકા ગાળાના પગલાં તુરંત આપવાથી પૂર્ણ થઈ શકે છે. ઈનોવેશન, ટેકનોલોજી અને સાહસિકતા, નિવેશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને કલા, સંસ્કૃતિ અને પ્રવાસન.

### સુવાક્યો

"આ લઘુ વ્યવસાય માસમાં અમને આપણા સ્થાનિક સાહસિકોની કદર કરતા ગર્વની લાગણી થાય છે જેઓ આપણા સમુદાયને કેટલું આપી રહ્યા છે જેમાં પાત્રતા, રોજગાર, સ્પર્ધાત્મકતા અને સમૃદ્ધિનો સમાવેશ થાય છે. હું તમામ બ્રેમ્પટનવાસીઓને આલ્વાન આપું છું કે અમારી સાથે આપણા સ્થાનિક લઘુ વ્યવસાયોને વધાવી લો અને સપોર્ટ કરો જે માત્ર ઓક્ટોબરમાં જ નહીં પરંતુ હંમેશા, ખાસ કરીને જ્યારે COVID-19 મહામારીને કારણે ધંધા બંધ થઈ રહ્યા છે. આ બધામાં આપણે સહુ ભેગા છીએ."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"COVID-19 મહામારીથી નાના ધંધાઓને મોટો ફટકો બેઠો છે અને લઘુ વ્યવસાય માસ આપણને સહુને એક સરસ તક પૂરી પાડે છે જેથી આપણે આપણા સ્થાનિક લોકોની કદર કરીએ જેમણે છેલ્લા મહિનાઓમાં અકલ્પનીય સ્થિતિસ્થાપકતા અને ચાતુર્ય દર્શાવ્યું છે. BEC દ્વારા પૂરું પાડવામાં આવતા પ્રોગ્રામિંગનો પૂરો લાભ લેવા હું લઘુ વ્યવસાયોને પ્રોત્સાહિત કરું છું અને તેમની આ બિઝનેસ માઈલસ્ટોન પ્રોગ્રામના અનુભવોની વાતો સાંભળવા ઉત્સુક છું."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4; પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રેમ્પટન.

"લઘુ વ્યવસાયો આપણા સમાજની કરોડરજ્જુ છે અને તેઓની સફળતા આપણા સ્થાનિક અર્થતંત્ર માટે અનિવાર્ય છે. આ લઘુ વ્યવસાય માસમાં તેમના બ્રેમ્પટન તરફ કરેલા યોગદાનને વધાવવા અમારી સાથે જોડાઓ અને ચોક્કસ જ સ્થાનિકને સમર્થન અપવાનું યાદ રાખશો."

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 & 5; ઉપ પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ, સીટી ઓફ બ્રેમ્પટન

"સીટી ઓફ બ્રેમ્પટન ખાતે કર્મચારીઓ, આપણે જ્યારે ફરી બેઠા થઈ રહ્યા છીએ ત્યારે આખા સમાજને મદદરૂપ થવા સમર્પિત છે, એવા સમયે જ્યારે આપણે સહુ ભેગા મળીને COVID-19ની મહામારીમાંથી ફરી ઊભા થઈ રહ્યા છીએ. આખા ઓક્ટોબરમાં અમારી ઈકોનોમિક ડેવેલપમેન્ટ ટીમ આપના સ્થાનિક લઘુ વ્યવસાયોને પ્રોગ્રામિંગ આપવા તેમજ સ્મોલ બિઝનેસ મન્યના માનમાં સ્મોલ બિઝનેસ માર્ઠલસ્ટોન પ્રોગ્રામ માટે થનગની રહી છે."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક**

પ્રભજોત કૈન્થ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Prabhjot.Kainth@brampton.ca](mailto:Prabhjot.Kainth@brampton.ca)